

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન પ્રવેશ કરે છે તેમના સુરક્ષિત પુનઃપ્રારંભના તબક્કા 2 માં

બ્રેમ્પટન, ઓન્ટારિયો (24 જૂન 2020) – ઓન્ટારિયો સરકારની રાજ્યના પુનઃ પ્રારંભના તબક્કા 2 માં રિજન ઓફ પીલ જશે એવી જાહેરાતને પગલે સીટી ઓફ બ્રેમ્પટન આગામી તબક્કામાં પ્રવેશ કરે છે.

તબક્કા 2 ના ભાગરૂપે સિટી સુરક્ષિત રીતે નીચેની સેવાઓ, સગવડો અને અવલતોનો પુનઃપ્રારંભ કરશે:

સમર કેમ્પસ

સિટી ઓફ બ્રેમ્પટન જુલાઈ 13 થી સપ્ટેમ્બર 4 સુધી 4 થી 10 વર્ષની વયના બાળકો માટે રજૂ કરે છે ફેરફાર કરેલ સમર કેમ્પસ. રજિસ્ટ્રેશન ઓનલાઈન ખુલશે જુન 29 મીથી તેમજ 311 મારફત. તમામ સહભાગીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રોગ્રામિંગમાં વધુ માત્રામાં વ્યક્તિગત કરાયેલ ઈન્ડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ સમાયેલ હશે. વધારાની સલામતી વ્યવસ્થાઓ પણ કરાશે જેમાં નીચેની બાબતો સામેલ છે:

- કેમ્પના જૂથ દીઠ મહત્તમ આઠ સહભાગીઓ અને બે પ્રશિક્ષકો
- કેમ્પના આગેવાનો વ્યક્તિગત રક્ષણાત્મક સાધન પહેરશે
- તમામ સગવડો પર સાફ સફાઈ અને જંતુમુક્ત કરવાની પ્રક્રિયામાં વધારો કરાશે

સ્પ્લેશ પેડ્સ અને પ્રોક્સેસર્સ લેક

આખા બ્રેમ્પટનમાં સ્પ્લેશ પેડ્સ શનિવારે, જુન 27 મીથી ખુલશે.

સિટી પ્રોક્સેસર્સ લેકને જુલાઈના મધ્યમાં ખોલવાની અપેક્ષા રાખે છે અને જનતાને બીચની પહોંચ આરક્ષણ કરવા માટેના બુકિંગ્સથી મળશે.

અરેનાઝ: ફિગર સ્કેટિંગ/હોકી તાલીમ

જુન 29 થી શરૂ થતાં અરેના ફક્ત તાલીમ માટે ખુલશે. આ સમયે કોઈપણ વોક-ઇન્સ સ્વીકારાશે નહીં અને બુકિંગ, સિટી સ્ટાફ મારફત 905-874-BOOK પર થશે. રેન્ટલ બુકિંગો જુન 25 ના રોજથી શરૂ થશે. વધારવામાં આવેલ સલામતી પગલાંમાં સામેલ છે વપરાશની મર્યાદા 10 સહભાગીઓ સુધીની રાખવી જેમાં પ્રશિક્ષકોનો સમાવેશ થાય છે. આ સમયે ચેંજ ડ્રેસનો ઉપયોગ થઈ શકશે નહીં.

સ્પોર્ટ્સ ફિલ્ડ્સ, ટ્રેક એન્ડ ફિલ્ડ, બાસ્કેટબોલ કોર્ટ્સ

જુન 26 થી આઉટડોર બાસ્કેટબોલના કોર્ટ્સ જાહેર ઉપયોગ માટે ઉપલબ્ધ થવાનું શરૂ થશે.

જુલાઈ 3 ના રોજ આઉટડોર સ્પોર્ટ્સ ફિલ્ડ્સ અને બેટિંગ કેજિસ માત્ર તાલીમ માટે પરવાનગી સાથેના ઉપયોગ માટે ઉપલબ્ધ રહેશે. આ સમયે કોઈપણ વોક-ઇન્સ સ્વીકારાશે નહીં અને બુકિંગ સિટી સ્ટાફ મારફત 905-874-BOOK પર થશે. ચેન્જ ડ્રમ્સનો ઉપયોગ થઈ શકશે નહીં. મહત્તમ 10 સહભાગીઓને ફિલ્ડ ટીક મંજૂરી મળશે જેમાં કોચનો સમાવેશ થાય છે.

પેશિયો બ્રમ્પટન

આજથી શરૂ, સિટી હંગામી પેશિયોના વિસ્તરણ માટે ખાદ્ય પદાર્થોના વ્યવસાયો પાસેથી અરજીઓ સ્વીકારે છે. બ્રમ્પટનનાં રેસ્ટોરન્ટો અને ખારને પોતાના પેશિયો કુટપાથ અને ખાનગી પાર્કિંગની જગ્યામાં પર વિસ્તારવાની મંજૂરી છે જેથી વધુ બેઠકોને સમાવી શકાય. વ્યવસાયો માટે વધુ માહિતી અહીં સિટીના [પેશિયો બ્રમ્પટન પૃષ્ઠ](#) પર ઉપલબ્ધ છે.

બ્રમ્પટનનું પુસ્તકાલય

પોતાની પુનઃ પ્રારંભ યોજનાના તબક્કા 2 તરીકે પસંદગીના બ્રાંચ લોકેશનો પર બ્રમ્પટન લાઈબ્રેરી સંપર્કરહિત કર્મ સાર્ઠડ પિક અપ સેવા ચાલુ કરવાની તૈયારી કરે છે, જે સિટી ઓફ બ્રમ્પટન અને પીલ પબ્લિક હેલ્થની સલાહ હેઠળ થશે. વિગતો અહીં www.bramptonlibrary.ca અને બ્રમ્પટન લાઈબ્રેરીના Facebook અને Twitter પર [@bramptonlibrary](#) તરીકે ઉપલબ્ધ છે.

લિંક:

- [રિક્રિએશન તબક્કો 2 પ્રોગ્રામ્સ અને સેવાઓની પુનઃશરૂઆત](#)
- [સિટીના પુનઃપ્રારંભ અને ક્લોઝરોની સંપૂર્ણ યાદી](#)
- [સિટી ઓફ બ્રમ્પટન રિઓપનિંગ એન્ડ રિકવરી](#)
- [સિટી ઓફ બ્રમ્પટન COVID-19 અપડેટ](#)

અવતરણો

"માળખાને પુનઃ ખોલવાના પ્રોવિન્સના ચિંતનાત્મક, પ્રાદેશિક અભિગમથી મને આનંદની લાગણી થાય છે. ત્રણ મહિના અગાઉ કટોકટી જાહેર કરવામાં આવી ત્યારથી જોવા જઈએ તો આજનો દિન એક સીમાચિહ્ન ગણાય તેમજ એક એવી ક્ષણ જે પીલ પબ્લિક હેલ્થની સલાહ અનુરૂપ આપણા સમાજની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. હું જાણું છું કે આપણા નાગરિકો અને વ્યવસાયો રોમાંચિત છે અને હું તમામ લોકોને યાદ અપાવું આપણે શ્રેષ્ઠ સ્વચ્છતા અને સલામતીની પ્રણાલિઓ અનુસરવી ચાલુ રાખવાની છે જેથી આપણી ફરી બેઠા થવાની પ્રક્રિયાની ગતિ જળવાયેલી રહે."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સિટી ઓફ બ્રમ્પટન

"રહેવાસીઓ અને સ્થાનિક હિસ્સાધારકો સાથે અનેક સપ્તાહ પ્રવૃત્ત રહીને યોજનાઓ બનાવ્યા બાદ સિટી પોતાની ઘણી બધી સવલતો સુરક્ષિત રીતે ખોલવા અને પ્રોવિન્સની જાહેરાત અનુરૂપ સેવાઓ ફરી ચાલુ કરવા તૈયાર થયું છે. હું આપણા સમાજને તેઓની એકધારી પ્રતિબદ્ધતા માટે આભાર વ્યક્ત કરું છું જેથી COVID-19 ફેલાતો ઓછો થયો છે અને જેઓએ આપણા શહેરના સંપૂર્ણ ઉત્થાનમાં યોગદાન આપ્યું છે."

- માર્ટિન મેડિરોસ (Martin Medeiros), રિજનલ કાઉન્સિલર, વોર્ડ 3 & 4 પ્રમુખ, મેયર્સ રિઓપનિંગ એન્ડ રિકવરી વર્કિંગ ગ્રૂપ, સિટી ઓફ બ્રમ્પટન

"સિટી આપણી સવલતો અને સગવડો ફરી ચાલુ કરવા માટે પીલ પબ્લિક હેલ્થ સાથે નજીકથી કાર્ય કરી રહ્યું છે જે તેમના આરોગ્ય અને સુરક્ષાની માર્ગદર્શિકા અને નિયમો અનુસાર છે. અમારી અગ્રિમતા કર્મચારીઓ, રહેવાસીઓ અને મુલાકાતીઓનું સ્વાસ્થ્ય છે તે સાથે આખા શહેરમાં સલામતીના પગલાં લેવામાં આવ્યા છે જ્યારે અમે અમારા સંગઠનના ક્ષેત્રો ફરી શરૂ કરવા જઈ રહ્યા છીએ."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે શેકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca